

ઘરફોડ કરનાર રીઢા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી, સુરત શહેર ક્રાઇમ બ્રાંચ.

સુરત શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા તથા ઘરફોડ ચોરી કરતા ઈસમોને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાંચના પો.સ.ઈ. એમ.એસ.ત્રિવેદી નાઓ તથા પો.કો. યોગેન્દ્રસિંહ દિલુભા તથા પો.કો. મહાવીરસિંહ રણજીતસિંહ નાઓને મળેલ બાતમી આધારે કાપોદ્રા સીલ્વર ચોક પાસેથી આરોપીઓ (૧) શાહરૂખ નિસારઅહમદ રૈની ઉ.વ.૨૩ રહે. મદીના મસ્જીદની પાછળ આવેલ અમન સ્કુલની સામે એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે, ઉઝેરભાઈના મકાનમાં લીંબાયત, સુરત શહેર (૨) હીરંજ ઉર્ફે ડાહ્યો ગણેશભાઈ રાઠોડ ઉ.વ.૨૮ રહે,બિલ્ડીંગ નં. એચ-૧, ૧૬, રૂમ નં.૨૧ કોસાડ આવાસ, અમરોલી, સુરત શહેર (૩) અજય ઉર્ફે લાલુ ધર્મેશભાઈ રાઠોડ ઉ.વ.૧૯ રહે. બિલ્ડીંગ નં. બી-૧, ૧૬, રૂમ નં.૨૨ કોસાડ આવાસ, અમરોલી, સુરત શહેરનાઓને ચોરીમા ઉપયોગમા લીધેલ (૧) ઓટો રીક્ષા કિ.રૂ.૧,૫૦,૦૦૦/- (૨) સોનાનુ પેન્ડલ કિ.રૂ ૧૫૦૦/- (૩) રોકડા રૂપીયા ૧૫,૦૦૦/- મળી કુલે કિ.રૂ. ૧,૬૬,૫૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સરથાણા પોલીસ સ્ટેશન I ગુ.ર.નં.૫૦૪/૨૦૧૯ ઈ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયેલ છે. તેમજ પુછપરછ દરમ્યાન આરોપીઓ રાત્રીના આશરે દોઢ વાગ્યે ભેગા મળી કબજે કરવામાં આવેલ ઓટો રીક્ષામાં બેસી સરથાણા ગોવિંદપાર્ક સોસાયટીમાં ગયેલ. જ્યાં એક બંધ મકાન પાસે આરોપી શાહરૂખ તથા હીરંજ ગયેલ અને તેઓએ મકાનનુ તાળુ પેચીયા તથા સળીયાની મદદથી તોડી, તેઓ ઘરમાં ગયેલ તથા સહ આરોપી અજય ઘરની બહાર છુપાઈ વોચ કરતો રહેલ. તથા અન્ય સહ આરોપી સૈફઅલી રીક્ષામાં દુર બેસી ચોરીનુ કામ પુરૂ થતા આરોપીઓને જગ્યા પર લેવા માટે ગયેલ. અને ચોરીમા મળેલ સોના ચાદીના દાગીના તથા રોકડા રૂપીયા સરખે ભાગે વહેંચી લીધેલ હોવાની હકીકત જણાવેલ છે. મજકુર આરોપીઓ પૈકી (૧) શાહરૂખ નિસારઅહમદ રૈની નીચે મુજબના ગુનાઓમાં પકડાઈ ચુકેલ છે. (૧) પુણા પો.સ્ટે. I ૧૪/૨૦૧૮ ઈ.પી.કો. ૪૫૭, ૩૮૦ (૨)ખટોદરા પો.સ્ટે. I ૧૫/૨૦૧૮ ઈ.પી.કો. ૪૫૭, ૩૮૦ આરોપી (૨)હીરંજ ઉર્ફે ડાહ્યો ગણેશભાઈ રાઠોડ નીચે મુજબના ગુનામાં પકડાઈ ચુકેલ છે. (૧)લીંબાયત પો.સ્ટે. I ૧૧૧/૨૦૧૬ ઈ.પી.કો. ૪૫૪, ૪૫૭,૩૮૦(૨)લીંબાયત પો.સ્ટે. I ૧૧૦/૨૦૧૬ ઈ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ (૩) લીંબાયત પો.સ્ટે. I ૧૫૨/૨૦૧૬ ઈ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ (૪) ડીંડોલી પો.સ્ટે. II ૬૭૩/૨૦૧૯ જી.પી.એક્ટ ૧૩૫ (૫)લીંબાયત પો.સ્ટે. II ૧૬૭/૨૦૧૯ જી.પી.એક્ટ ૧૩૫.